

ત્વરિત જાહેરાત માટે

સિટી ઓફ બ્રમ્પટન ઓપરેશન લાઈફસેવર સાથે હાથ મિલાવે છે જેથી રેલવે ક્રોસિંગ વિશે જાગૃકતા ઊભી કરી શકાય

બ્રમ્પટન, ઓન્ટારિયો (24 સપ્ટેમ્બર 2021) – આજે સિટી ઓફ બ્રમ્પટને ઓપરેશન લાઈફસેવર અને HUB સર્ફેસ સિસ્ટમ્સ સાથે ભાગીદારીમાં નવા રેલવે સુરક્ષા ડિકલ્સ (ટકાઉ સ્ટિકરો)નું અનાવરણ લૂક (જુઓ) લિસન (સાંભળો) લિવ (જીવો) ના ભાગરૂપે બ્રમ્પટન GO સ્ટેશન ખાતે કર્યું. કમ્યુનિટી સુરક્ષા ભાગીદારી પ્રોગ્રામ.

દર વર્ષે, ડઝનબંધ કેનેડિયનો રેલવેના ક્રોસિંગો પર થતી અથડામણોમાં માર્યા ગયા છે અથવા ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા છે.

[ઓપરેશન લાઈફસેવર](#) તેવા સ્થળો ઓળખવા માટે નગરપાલિકાઓ સાથે કામ કરે છે જ્યાં લોકોને સ્મૃતિ કરાવવા માટે સુરક્ષા ડિકલ્સ ઈન્સ્ટોલ કરી શકાય કે રેલવે ક્રોસિંગની આસપાસ સાવધાન અને સજાગ રહેવું.

ડિકલ્સનો ધ્યેય રાહદારીઓ, સાર્થકલ સવારો અને ડ્રાઈવરોને રેલવે ક્રોસિંગની આસપાસ સાવચેત રહેવાની જરૂરિયાતથી વધુ જાગૃત કરીને ક્રોસિંગની દુઃખદ ઘટનાઓને અટકાવવાનો છે. આ ડિકલ્સ થર્મોપ્લાસ્ટિક પદાર્થથી બનેલો છે જે ક્રુટપાથના નિશાનોની આવરદા મહત્તમ કરી આપે છે.

બ્રમ્પટનની રોડ ઓપરેશન ટીમ શહેરમાં રેલવેના ક્રોસિંગ પર આઠ ડિકલ્સ લગાવશે જેમાં સામેલ છે:

- ચાર ડિકલ્સ મિલ સ્ટ્રીટ અને રેઈલરોડ સ્ટ્રીટ પર; અને
- ચાર ડિકલ્સ જેમ્સ સ્ટ્રીટ અને જોહન્સ સ્ટ્રીટ પર.

ઓપરેશન લાઈફસેવર વિશે વધુ માહિતી માટે મુલાકાત લો operationlifesaver.ca

સુવાક્યો

"બ્રમ્પટન એક સ્વાસ્થ્યપ્રદ અને સુરક્ષિત શહેર છે. રેલવે ક્રોસિંગની આસપાસ સજાગ રહેવાના મહત્ત્વ અંગે જાગૃકતા વધારવા માટે ઓપરેશન લાઈફસેવર સાથે ભાગીદારી કરવાનું મને ગૌરવ છે. ફક્ત એક દુઃખદ ઘટના પણ નોંધપાત્ર ગણાય અને મને આશા છે કે આ પહેલ અને આ ડિકલ્સ આપના સમાજમાં જાગૃકતા ફેલાવશે.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"ઓપરેશન લાઈફસેવર સાથે કરેલ ભાગીદારીનું ધ્યેય જાહેર જનતાને રેલવે ક્રોસિંગ્સની આસપાસ રહેલ જોખમોથી જાગૃત કરીને જીવ બચાવવાનો છે. તમામ બ્રેમ્પટનવાસીઓની સલામતી અત્યંત મહત્વપૂર્ણ છે અને તે અગત્યનું છે કે તમામ લોકો પોતાની સુખાકારી માટે પોતાની આસપાસની પરિસ્થિતિઓથી વાકેફ રહે.

- પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 1 અને 5; પ્રમુખ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રેમ્પટન

"સિટી ઓફ બ્રેમ્પટન અમારા રહેવાસીઓ અને સમસ્ત સમાજની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. ઓપરેશન લાઈફસેવર સાથેની આ ભાગીદારી રાહદારીઓ, સાર્થકલ સવારો અને મોટર ચાલકોની બ્રેમ્પટનના રેલવે ક્રોસિંગ્સની આસપાસની સલામતી સુરક્ષિત કરવામાં અતિમહત્વની છે."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

"રેલવે ક્રોસિંગ પર થતી આકસ્મિક ઘટનાઓ આ દેશમાં આટલી સામાન્ય છે તે દુઃખદ બાબત છે અને આવી દરેક ઘટના ભોગ બનનાર વ્યક્તિના પરિવાર અને મિત્રોને તો પ્રભાવિત કરે જ છે, પણ સાથે રેલવેના કર્મચારીઓ, પ્રથમ જવાબી કાર્યવાહી કરનાર વ્યક્તિઓ અને આસપાસના સમાજને પન અસર કરે છે. આ પ્રોગ્રામનું ધ્યેય જાહેર જનતાને રેલવે ક્રોસિંગ્સની આસપાસ રહેલ જોખમોથી જાગૃત કરશે અને આશા રાખવામાં આવે છે કે તેનાથી ઘણાં જીવ બચાવી શકાશે. અમને જોઈએ છે કે લોકો થોડા ધીમા પડે, આજુબાજુ જુએ, આવી રહેલ ટ્રેનોના અવાજ સાંભળે અને તમામ રેલવે ચેતવાણીના ચિહ્નો અને સંકેતો પર ધ્યાન આપી તેનું પાલન કરે.

- સારા મેસ (Sarah Mayes), નેશનલ ડિરેક્ટર ઓફ ઓપરેશન લાઈફસેવર કેનેડા

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

પ્રભજોત કૈન્થ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ (Strategic Communication)

સિટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca

